

## જીવન (JIVAN- Jail Inmates Visit Application Network) સીસ્ટમથી વિડીયો મુલાકાતના નિયમો.

૧. ગુજરાત જેલ વિભાગ દ્વારા ટુંક સમયમાં જીવન (JIVAN- Jail Inmates Visit Application Network) સીસ્ટમ દ્વારા કેદી/આરોપીઓ માટે ઇ મુલાકાતની સુવિધા શરૂ કરવામાં આવનાર છે.
૨. જીવન-સીસ્ટમ મારફતે મુલાકાત લેવા માંગતા આરોપી/કેદીઓએ તેમના મુલાકાતી-સગાઓની યાદી આપવાની રહેશે.
૨. જીવન સીસ્ટમ દ્વારા મુલાકાત લેવા માટે જીવન સીસ્ટમના જેલ વિભાગની વેબસાઇટ ઉપર રહેલ વેબપોર્ટલ ( [www.prison.gujarat.gov.in/jivan](http://www.prison.gujarat.gov.in/jivan) ) લીંક ઓપન કરતાં એક મુલાકાતી ફોર્મ ઓપન થશે. સદર ઓનલાઇન ફોર્મમાં જરૂરી વિગતો ભરી સબમીટ કરવાની રહેશે. આ વિઝીટર ફોર્મ મુલાકાતના અગાઉના દિવસે ભરવાનું રહેશે.
૩. મુલાકાતી દ્વારા વિગતો ભરી સબમીટ કરવામાં આવેલ ફોર્મ જે તે જેલના જીવન સીસ્ટમના ઇમેઇલ આઇ.ડી. ઉપર પ્રાપ્ત થશે. જે જે તે જેલના મુલાકાત જેલર/સંબંધિત સત્તાધિકારી દ્વારા ચેક કરી મંજૂર/ નામંજૂર કરવામાં આવશે. જે મંજૂર/નામંજૂર થયા અંગે મુલાકાતીને તેમના ઇમેઇલ આઇ.ડી. ઉપર તથા તેમના મોબાઇલ નંબર ઉપર જાણ કરવામાં આવશે. સદર મુલાકાત મંજૂર કરવામાં આવેલ હશે તો મુલાકાતની તારીખ અને મુલાકાતનો સમય દર્શાવતો ઇમેઇલ તથા એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવશે. આ કામગીરી માત્ર કચેરીના જાહેર રજાના દિવસો સિવાયના ચાલુ દિવસોમાં કરવામાં આવશે.
૪. જીવન સીસ્ટમ દ્વારા મુલાકાતનો સમયગાળો ૨૦ મિનીટનો રહેશે.
૫. જીવન સીસ્ટમ દ્વારા આપવામાં આવનાર મુલાકાતના તમામ નિયમો મેન્યુઅલી મુલાકાતના જ યથાવત રહેશે.
૬. જીવન સીસ્ટમ દ્વારા આપવામાં આવતી તમામ મુલાકાતનું વિડીયો રેકોર્ડિંગ થશે.
૭. નીચે જણાવેલ ગુના હેઠળના કેદીઓ/આરોપીઓને જીવન સીસ્ટમ હેઠળ મુલાકાત મળવાપાત્ર નથી.

૧. રાજ્ય વિરૂધ્ધના ગુનામાં તથા આતંકવાદી પ્રવૃત્તિવાળા કેદી
૨. ધાડ/એક કરતાં વધારે ખુન, લુંટ, પોટા, ખંડણી અને અપહરણ
૩. ગેંગના ગુનામાં સંડોવાયેલા
૪. આંતર રાષ્ટ્રીય ગુનેગારો
૫. એન.એસ.એ. (નેશનલ સીક્યુરીટી એક્ટ) ના આરોપી
૬. પાસાના અટકાયતી
૭. પોટા ટાડા હેઠળ સજા પામેલ કેદીઓ

૮. અનલોફલ એકટીવીટીઝ (પ્રિવે.) એકટ.

૯. એન.ડી.પી.એસ. તેમજ કોફે પોસા એકટ

૧૦. આર્મ્સ એન્ડ એક્ષ્લોઝીવ એકટ

૧૧. બળાત્કાર/સામુહિક બળાત્કારના ગુનાના આરોપી/કેદીઓ

૮. મુલાકાત બાબતે BJM રૂલ્સ તથા સરકાર શ્રીના વખતોવખતના અમલમાં હોય તે ઠરાવો/ પરીપત્રો વિગેરે લાગુ પડશે.

૯. જીવન સીસ્ટમ દ્વારા આપવામાં આવતી મુલાકાત દરમ્યાન કેદી/આરોપી દ્વારા જેલમાં બનતી ઘટનાઓની આપલે/જેલવહીવટ સુરક્ષા વિરૂધ્ધની, રાજ્ય કે દેશ વિરૂધ્ધની ધમકીવાળી ભાષામાં કોઈ પણ પ્રકારની ગુનાહિત વાતચીત કરી શકશે નહિ. આવી બાબત ધ્યાન ઉપર આવે તો તરત જ મુલાકાત રદ કરી વાતચીત અટકાવી કસુરદાર કેદી/આરોપી સામે જેલ મેન્યુઅલના નિયમોઅનુસાર જેલ શિક્ષા કરવાની રહેશે.